



Ahmedabad Municipal Corporation

As per Gujarat Town Planning & Urban Development Act, 1976, section 29(1), 34, 49(1)(B) &
The Bombay Provincial Municipal Corporation Act, 1949, section 253/254

Commencement Letter (Rajachitthi)

Date: 24/06/2013

Case No: BLNTR/EZ/140513/P/B6600/R0/M1
Rajachitthi No.: 33827/140513/B6600/R0/M1
Arch./Engg. No.: ER0783200216 Arch./Engg. Name: PATEL NILESHKUMAR NARAYANBHAI
S.D. No.: SD0349200216 S.D. Name: DESAI JAYESH DINESHCHANDRA
C.W. No.: CW0369020517R1 C.W. Name: PATEL NILESHKUMAR NARANBHAI
Owner Name: (1) RAMESHBHAI BABUBHAI (2) RAMESHBHAI RAVJIBHAI (3) JAGDISHBHAI BHAGVANJIBHAI
Address: 14, KAILASHDHAM SOCIETY PART-I, INDIA COLNY ROAD, BAPUNAGAR, AHMEDABAD
Occupier Name: (1) RAMESHBHAI BABUBHAI (2) RAMESHBHAI RAVJIBHAI (3) JAGDISHBHAI BHAGVANJIBHAI
Address: 14, KAILASHDHAM SOCIETY PART-I, INDIA COLNY ROAD, BAPUNAGAR, AHMEDABAD
Election Ward: 52-Vastral Zone: East
TP Scheme T.P.S. No: 113(Vastral) Final Plot No 117 (R.S.NO.1139/36)
Sub Plot No: Block/Tenament: BLOCK-A (TENA NO. 1 TO 5)
Site Address: F.P.NO.117, YOGESHWAR PARK, VASTRAL RING ROAD, VASTRAL, AHMEDABAD-382418.
Height of Building: 9.75 METER

Floor Name	Floor Usage	Built up Area (in SQ. MT.)	Total Nos. of Residential Units	Total Nos. of Non Residential Units
Ground Floor	Residential	431.92	5	0
First Floor	Residential	431.92	0	0
Second Floor	Residential	243.49	0	0
Total		1107.33	5	0

Dishor
24/06/2013
Sub Inspector
(Civic Center)

24-6-13
Asst. T.D.O./Asst. E.O.
(Civic Center)

Rajendra
RAJENDRA JADAV
Dy TDO
East

I.K. Patel
I.K. PATEL
Dy MC
East

Note / Conditions:

- (1) THIS DEVELOPMENT PERMISSION IS GRANTED WITH CONDITION THAT APPLICANT AND ENGG./ARCH. WILL OBEY AS PER ALL BONDS AND AFFIDAVITS PRODUCED BY APPLICANT AND ENGG./ARCH.
- (2) THE OWNER/DEVELOPER SHALL CARRY OUT RAIN WATER HARVESTING SYSTEM AS SPECIFIED BY AUTHORITY ACCORDING TO LETTER OF URBAN DEV. AND URBAN HOUSING DEPT. GANDHINAGAR DT. PRH/102004/1961/L DT. 27/07/04 ANN. A.
- (3) THIS APPROVAL IS GIVEN ACCORDING TO MUNICIPAL COMMISSIONER OFFICE ORDER DATED 02/03/05 AND OFFICE ORDER NO-42, DT. 13/06/06.
- (4) THIS PERMISSION IS GRANTED ONLY FOR THE PROPOSED BUILDING (BLOCK). CORRECTNESS / APPROVAL FOR THE REMAINING STRUCTURES/BUILDING OTHER THAN THIS PROPOSED BUILDING (BLOCK) SHOWN IN THIS PLAN ARE NOT ENDORSED BY THIS PERMISSION, IN ANY MANNER AND ARE SHOWN FOR THE ORIENTATION PURPOSE ONLY.
- (5) * THIS PERMISSION IS GRANTED SUBJECT TO CONDITION THAT IN THE PLOT/BUILDING UNIT WHERE DRAINAGE-SEWERAGE CONNECTION TO AMC NETWORK IS NOT FEASIBLE DUE TO NON-WORKING STATUS OF THE SEWERAGE NETWORK THE OWNER / APPLICANT WILL HAVE TO PROVIDE FACILITY OF SEPTIC TANK-WITH SOAK WELL IN THE BUILDING UNIT (AS PER CIRCULAR NO:- 18/2011-2012).
- (6) THIS CASE HAS BEEN SCRUTINIZED AND APPROVED BY BUILDING PLAN SCRUTINY POOL ON DT:-11/06/2013.
- (7) THIS PERMISSION IS GIVEN ON THE BASIS OF MEASUREMENT & LOCATION OF PLOT MENTION IN OPINION FOR SCHEME IMPLEMENTATION GIVEN BY TOWN DEV. INSP. (EZ) A.M.C. ON DT:-08/04/2013.
- (8) THIS PERMISSION IS GIVEN ON THE BASIS OF OPINION FOR NET DEMAND (BETTERMENT CHARGES) GIVEN BY ASSIT. CITY PLANNER, CITY PLANNING DEPT. IN THEIR LETTER NO:-CPD/A.M.C./GEN./153 ON DT:-10/04/2013.
- (9) ALL RELEVANT TERMS AND CONDITIONS MENTIONED IN N.A. PERMISSION GIVEN BY DY.COLLECTOR (VIRAMGAM) DATE:-15/03/2007 VIDE LETTER NO:-LAND/NA/C-2057/07/SR-11/2007, WILL BE APPLICABLE AND BINDING TO OWNER/APPLICANT.
- (10) THIS PERMISSION IS GRANTED AS PER T.P.I. OPINION ON DT:-03/06/2013, THE FINAL PLOT IS SITUATED OUTSIDE THE BOUNDARY OF HAZARDOUS WASTE LAND & FILLING SITE

For Other Terms & Conditions See Overleaf

આગળના પેજ પર કમેન્સમેન્ટ સર્ટીફિકેટ (રજાચિકી)ની જણાવેલ શરતો ઉપરાંત નીચે જણાવ્યા મુજબની શરતોએ ધી યુ. ટા. પ્લા. અને અર્બન ડેવ. એક્ટ, ૧૯૭૬ની કલમ-૨૮ (૧), ૩૪, ૪૯, ૫૨ તથા ધી બી. પી. એમ. સી. એક્ટ ૧૯૪૮ની કલમ ૨૫૩ તથા ૨૫૪ ની જોગવાઈઓને આધિન આ પરવાનગી આપવામાં આવે છે.

:: શરતો ::

- ધી. બોમ્બે પ્રો. મ્યુ. કો. એક્ટ, ૧૯૪૮ ધી યુ. ટા. પ્લા. અને અર્બન ડેવ. એક્ટ, ૧૯૭૬, ટાઉન પ્લાનિંગ સ્કીમના રેગ્યુલેશન, સામાન્ય વિકાસ નિયંત્રણ નિયમો તેમજ પ્રવર્તમાન નીતિ-નિયમોને અનુસરીને મકાન બાંધકામ તેમજ ઉપયોગ કરવાની રહેશે. તેમજ આ અંગેના તમામ કાયદા તેમજ પોતા કાયદાનું પાલન કરવાનું રહેશે. તેમજ તેમાં જે કોઈ અંકુશો તથા શરતો મુકવામાં આવી છે તેનાથી જે નુકશાન થતું હશે તે પક્ષ નુકશાનની બદલો માંગ્યા સિવાય અરજદાર/માલિકે તેનો અમલ કરવાનો રહેશે.
- અરજદાર/માલિકને કમેન્સમેન્ટ સર્ટીફિકેટ (રજાચિકી) આપવામાં આવ્યું હશે તે પક્ષ ધી યુ. ટા. પ્લા. અને અર્બન ડેવ. એક્ટ, ૧૯૭૬ મુજબ ટા. પ્લા. સ્કીમ અન્વયેની ડિમાન્ડ/ફાળો તેમજ અન્ય કાયદા હેઠળ કોઈ ચાંજ કે લેણાં બાકી હશે કે ભવિષ્યમાં ચૂકવવાના થશે તે તેમજ કોર્પો./સશમ સત્તામાં જમા કરાવવાના રહેશે.
- અરજદાર/માલિકને કમેન્સમેન્ટ સર્ટીફિકેટ (રજાચિકી) માં જણાવ્યા મુજબની શરતોનું પાલન કરવાનું રહેશે. કમેન્સમેન્ટ સર્ટીફિકેટ (રજાચિકી)માં જણાવ્યા મુજબની શરતો પૈકી કોઈપણ શરતોનું ઉલ્લંઘન કરવામાં આવશે તે મ્યુનિસિપલ કોર્પોરેશન તે શરતોનો અમલ કરાવી શકશે. અને મ્યુનિસિપલ કોર્પોરેશનના તેવા કૃત્યને લીધે જે કોઈ નુકશાન, ખોટ, કહરાવટ અરજદાર/માલિકને થશે તે બદલ કોઈપણ પ્રકાર નો બદલો મળી શકશે નહીં.
- કમેન્સમેન્ટ સર્ટીફિકેટ (રજાચિકી) ની તારીખથી એક વર્ષમાં બાંધકામ શરૂ કરવામાં આવેલ નહીં હોય કે નિયત સમયમર્યાદામાં તેના રીન્યુઅલ અંગેની કાયદાકીય કાર્યવાહી કરવામાં આવેલ નહીં હોય તો કમેન્સમેન્ટ સર્ટીફિકેટ (રજાચિકી) સહિત આપેલ પરવાનગી આપો આપ રદ થયેલ ગણાશે.
- મંજૂર થયેલ પ્લાન મુજબનું સ્થળ પર બાંધકામ પુરું થયેથી ધી. બોમ્બે પ્રો. મ્યુ. કો. એક્ટ, ૧૯૪૮ ની કલમ-૨૬૩ તેમજ સામાન્ય વિકાસ નિયંત્રણ નિયમ(જી.ડી.સી.આર.) ની જોગવાઈ મુજબ મકાન વપરાશની પરવાનગી (બી. યુ. પરમીશન) મેળવ્યા બાદ જ મંજૂર કરેલ બાંધકામનો વપરાશ કરી શકાશે.
- ધી. બો. પ્રો. મ્યુ. કો. એક્ટ, કલમ-૩૭૬ ધી ૩૮૮માં નિર્દિષ્ટ કર્યા પ્રમાણેના ધંધા અગર ઉપયોગ માટે કોઈપણ જગ્યાનો ઉપયોગ કરતા પહેલાં અમ. મ્યુનિ. કોર્પોરેશન/સશમ સત્તા પાસેથી જરૂરી લાયસન્સ/પરવાનગી મેળવવાના રહેશે. પ્લોટના માપો તથા ભેતફળ મળી રહેતા હોય તેમજ જી.ડી.સી.આર. ૪૪૨, ૨ અનુસાર બાંધકામ માટેની સાઈટ તરીકે પ્લોટ યોગ્ય થાય અને પ્લોટ સ્વચ્છ અને ઢોળાવવાળો (બાગ-પોલાણનો ભાગ રહે નહીં અને પાણી ભરાઈ રહે નહીં તેવો) થાય તો જ બાંધકામ શરૂ કરી શકાશે.
- GRANT OF THIS DEVELOPMENT PERMISSION SHALL NOT MEAN ACCEPTANCE OF CORRECTNESS, CONFIRMATION APPROVAL OR ENDORSEMENT OF TITLE OF THE LAND OR BUILDING BASEMENT RIGHTS, VARIATION OF THE AREA FROM RECORDS, STRUCTURAL REPORTS & STRUCTURAL DRAWINGS, WORKMANSHIP AND SO. INVESTIGATION REPORT ETC. AND SHALL NOT BIND OR RENDER THE AUTHORITY/AMC OFFICIALS LIABLE IN ANY WAY IN THIS REGARD UNDER G.D.C.R. 5.3.1)
- પ્લાનમાં મંજૂર કર્યા મુજબનું બાંધકામ સ્થળ ઉપર શરૂ કરતા પહેલાં બીન પરવાનગીના બિન અધિકૃત કાચા - પાકા બાંધકામ અરજદાર/માલિકે પોતાના બાંધકામના ઉપર શરૂ કરવામાં રહેશે.
- પ્લાનમાં મંજૂર કર્યા મુજબનું બાંધકામ સ્થળ ઉપર શરૂ કર્યા સામાન્ય વિકાસ નિયંત્રણ નિયમ(જી.ડી.સી.આર.) મુજબ તબક્કાવાર પ્રોગ્રેસ ચેક કરાવવાના રહેશે.
- કેસમાં રજૂ કરવાના થતા સીઈલ રીપોર્ટ, સ્ટ્રક્ચરલ એન્જીનીયરિંગ, સ્ટ્રક્ચરલ ડ્રોઈંગ, બોન્ડિંગ બાંધકામ વિગેરે ફક્ત કોર્પોરેશનના રેકર્ડ હેતુ માટે હોઈ તે અંગેની જવાબદારી અ.મ્યુ. કોર્પોરેશનની તથા અધિકારી / કર્મચારીની રહેશે નહીં. આ અંગે જવાબદાર અરજદાર/માલિક / ઉવલપર તથા એન્જીનીયર/માલિકેટ સ્ટ્રક્ચરલ એન્જીનીયર, ક્લાર્ક ઓફ વર્ક્સ રજુ કરેલ પ્રમાણપત્રો / બાંધકામ તથા રીપોર્ટને આધીન સવળી જવાબદારી તેઓની (અરજદાર/માલિક / ઉવલપર તથા એન્જીનિયર / આર્કિટેક્ટ સ્ટ્રક્ચરલ એન્જીનીયર, ક્લાર્ક ઓફ વર્ક્સ) રહેશે.
- બીલ્ડીંગ મટીરીયલ્સ કે કાટમાળ મ્યુ. રસ્તા ઉપર કે ફુટપાથ ઉપર નાંખવામાં આવશે તો તેના કારણે રસ્તા કે ફુટપાથને જે કોઈ નુકશાન થશે તેનું ખર્ચ વસતી નિયમાનુસારની પેનલ્ટીની રકમ અરજદાર/માલિક પાસેથી વસૂલ કરવામાં આવશે. તેમજ આ બાંધકામની કમેન્સમેન્ટ સર્ટીફિકેટ (રજાચિકી) રદ કરવા અંગેની કાર્યવાહી કરવામાં આવશે.
- સામાન્ય વિકાસ નિયંત્રણ નિયમ(જી.ડી.સી.આર.) ની જોગવાઈ તેમજ જે તે સમયે સરકારી દ્વારા જાહેર કરાયેલ નીતી અનુસાર પરકોલેટીંગવેલ/પીટ, વોટર હાઉસિંગ, ટ્રીપ્લાન્ડેશન વૃક્ષારોપણની જોગવાઈ બીલ્ડીંગ પ્લોટમાં કરવાની રહેશે. સેપ્ટીક ટેન્ક તથા સોંકવેલની સાઈઝ તથા સંખ્યા, ડિસ્પોઝીશન એન્ડ મેન્ટેન્સન્સ વિગેરે અને જોગવાઈ ઉપરના બિતાયા મુજબના સ્થળે કરવાની જવાબદારી અરજદાર/માલિક/ઉવલપર તથા એન્જીનીયર/આર્કિટેક્ટ સ્ટ્રક્ચરલ એન્જીનીયર, ક્લાર્ક ઓફ વર્ક્સની રહેશે.
- મકાનમાં બાંધકામ/ડીમોલીશ કરતી વખતે અથવા ત્યાર બાદ આજુબાજુના મકાનો/મિલકતોને અન્ય કોઈપણ જાતનું નુકશાન કે જાન થશે તો તેની સંપૂર્ણ જવાબદારી અરજદાર/માલિક / ઉવલપર તથા એન્જીનીયર / આર્કિટેક્ટ સ્ટ્રક્ચરલ એન્જીનીયર, ક્લાર્ક ઓફ વર્ક્સની રહેશે. અ.મ્યુ. કોર્પોરેશન આ બાબતે દિવાનીયાકી જરૂરી રાહ જવાબદાર ગણાશે નહીં. તેમજ આજુબાજુના રહીશોને કોઈપણ સમયે ખલેલ / નુકશાન થાય નહીં તે રીતે બાંધકામ / ડિમોલીશનની કામગીરી કરવાની રહેશે.
- મંજૂર થયેલા પ્લાન તેમજ કમેન્સમેન્ટ સર્ટીફિકેટ (રજાચિકી) ની નકલ દરેક મેમ્બરને ફરજિયાત આપવાની રહેશે. અને બાંધકામની સાઈટ પર નોટિસ બોર્ડ ઉપર જાહેરમાં જોઈ શકાય તે રીતે દર્શાવવાની રહેશે.
- મકાન વપરાશની પરવાનગી (બી. યુ. પરમીશન) મેળવ્યા બાદ જ રેનેજ / પાણી તથા અન્ય સર્વિસ-યુટીલીટી માટે નિયમાનુસાર અરજ કરી શકાશે.
- બાંધકામ તથા અન્ય બાબતો સામાન્ય વિકાસ નિયંત્રણ નિયમ(જી.ડી.સી.આર.) સાથે સુસંગત નહીં હોય કે સામાન્ય વિકાસ નિયંત્રણ નિયમ(જી.ડી.સી.આર.)ના વિનિયમ ૩.૮ મુજબ અરજદાર/માલિકે ખોટી રજૂઆત અથવા ખોટા દસ્તાવેજો પ્રસાર કરેલ હશે તો આ કમેન્સમેન્ટ સર્ટીફિકેટ (રજાચિકી) તથા મંજૂર થયેલ પ્લાન આપો આપ રદ થયેલ ગણાશે.
- ઓવરહેડ અને અન્ડરગ્રાઉન્ડ પાણીની ટાંકી હેલ્થ હિસ્ટ્રી ટાંકાથી અંધ રાખવી ગટરની વેન્ટ પાઇપ ઉપર ઝીણું કંપું બાંધીને રાખવું અથવા પાતળા વાયરની જાળી રાખવી. મેલેરીયા કર્મચારી માટે ઓવરહેડ ટાંકીની તપાસ માટે સીડીની વ્યવસ્થા કરવી.
- કન્સ્ટ્રક્શન / ડિમોલીશનની પ્રગતિ દરમિયાન પ્લોટની રસ્તા તરફની બાજુએ ઓછામાં ઓછી ૩મી. ઊંચાઈની પતરાની વાડ (બેરીકેડ) સલામતિના હેતુસર કરવાની રહેશે.
- RESPONSIBILITY (G.D.C.R. 5.5(h)) : Approval of drawings and acceptance of any statement, Documents, Structural report, Structural drawings, Progress Certificate or Building Completion certificates shall not discharge the Owner, Engineer, Architect, Clerk of Works/Site Supervisor, Structural Designer, Developer, Owner From their responsibilities, Imposed under the act, The General development control Regulations and the Laws of Town and Local acts.
- LIABILITY (G.D.C.R. 5.4) : Notwithstanding any development permission granted under the act and these regulations, any person undertaking any development work shall continue to be wholly and solely liable for any injury or damage or loss whatsoever that may be caused to any one in or around the area during such construction and no liability whatsoever in this regard shall be cast on the authority.
- શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગના પત્ર ક્રમાંક નં. પરચ/૮૦૨૦૧૦/૬૩૨૫/પી.તા. ૧૬-૧૧-૧૦ ના પત્ર અનુસાર બાંધકામની જગ્યાએ મોટા અંશરે ગુજરાતી ભાષામાં બાંધકામની તમામ વિગતો દર્શાવતું બોર્ડ કાયમી મુકવાની શરતે.

ઉપર જણાવેલ કોઈપણ શરતોની ભંગ થશે તો આપેલ બાંધકામનું આરંભ પ્રમાણપત્ર (રજાચિકી) રદ કરવામાં આવશે.

આ કમેન્સમેન્ટ સર્ટીફિકેટ (રજાચિકી) દ્વારા જે વિકાસ કરવા પરવાનગી આપેલ છે તે અમે વિકાસ પરવાનગી મેળવવા જે પ્લાન સાથે અરજ તેમજ બાંધકામ રજૂ કરેલી તેના આધારે છે. માટે અરજમાં કે પ્લાનમાં અમારા દ્વારા કરવામાં આવેલ રજૂઆત સામાન્ય વિકાસ નિયંત્રણ નિયમ(જી.ડી.સી.આર.)ના નિયમો સાથે સુસંગત નહીં હોય તેમજ બાંધકામ કે અરજમાં અમારા દ્વારા કરવામાં આવેલ રજૂઆત ખોટી હશે તો આ કમેન્સમેન્ટ સર્ટીફિકેટ (રજાચિકી) રદ થયેલી ગણાશે તથા કરેલ બાંધકામ અમારા પક્ષે અને અમારે સમુદાયના મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરી શકશે અને કરેલ બાંધકામ દૂર કરવા અંગેના કાયદા અંગ્રીકા મકાનની નોટિસ પ્રમાણે રદ કરવામાં આવશે. આ કમેન્સમેન્ટ સર્ટીફિકેટ (રજાચિકી)ની ઉપરોક્ત તમામ શરતો એ/અમે વાંચેલ છે અને તે સાથે અમે સંમત છીએ.

માલિક / અરજદારની સહી
 ૧. Vaidhavanam Aji
 ૨. Prakashnagar Society
 ૩. Mahanagar Chawl, Mahanagar
 ૪. Mahanagar Chawl, Mahanagar



Ahmedabad Municipal Corporation

As per Gujarat Town Planning & Urban Development Act, 1976, section 29(1), 34, 49(1)(B) & The Bombay Provincial Municipal Corporation Act, 1949, section 253/254

Commencement Letter (Rajachithi)

Date: 24 JUN 2013

Case No.: BLNTR/EZ/140513/PIB6601/R0/M1
 Rajachithi No.: 33828/140513/B6601/R0/M1
 Arch./Engg. No.: ER0783200216
 S.D. No.: SD0349200216
 C.W. No.: CW0369020517R1
 Owner Name: (1) RAMESHBHAI BABUBHAI (2) RAMESHBHAI RAVJIBHAI (3) JAGDISHBHAI BHAGVANJIBHAI
 Address: 14, KAILASHDHAM SOCIETY PART-I, INDIA COLNY ROAD, BAPUNAGAR, AHMEDABAD
 Occupier Name: (1) RAMESHBHAI BABUBHAI (2) RAMESHBHAI RAVJIBHAI (3) JAGDISHBHAI BHAGVANJIBHAI
 Address: 14, KAILASHDHAM SOCIETY PART-I, INDIA COLNY ROAD, BAPUNAGAR, AHMEDABAD
 Election Ward: 52-Vastral
 TPS Scheme: T.P.S. No. 113(Vastral)
 Sub Plot No.:
 Site Address: F.P. NO. 117, YOGESHWAR PARK VASTRAL RING ROAD VASTRAL, AHMEDABAD 382418
 Height of Building: 9.75 METER
 Zone: East
 Final Plot No.: 117 R.S. NO. 1139/36
 Block/Tenament: BLOCK B TENAMENT NO. 6 TO 10

Floor Name	Floor Usage	Build Up Area (In Sq. Mtr.)	Total Nos. of Residential Units	Total Nos. of Non Residential Units
Ground Floor	Residential	431.92	5	0
First Floor	Residential	431.92	0	0
Second Floor	Residential	243.49	0	0
Total		1107.33	5	0

Dis. No.
24.6.13
Sub-Inspector

24.6.13
Asst. T.D.O./Asst. E.O.
(Civic Center)

Rajendra
RAJENDRA JADAV,
Dy TDO
East

I.K. Patel
I.K. PATEL
Dy MC
East

Note / Conditions:

- (1) THIS DEVELOPMENT PERMISSION IS GRANTED WITH CONDITION THAT APPLICANT AND ENGG./ARCH. WILL OBEY AS PER ALL BONDS AND AFFIDAVITS PRODUCED BY APPLICANT AND ENGG./ARCH.
- (2) THE OWNER/DEVELOPER SHALL CARRY OUT RAIN WATER HARVESTING SYSTEM AS SPECIFIED BY AUTHORITY ACCORDING TO LETTER OF URBAN DEV. AND URBAN HOUSING DEPT. GANDHINAGAR DT. PRH/102004/1961/LT. 27/07/04 ANN.X.A.
- (3) THIS APPROVAL IS GIVEN ACCORDING TO MUNICIPAL COMMISSIONER OFFICE ORDER DATED 02/03/05 AND OFFICE ORDER NO. 42 DT. 15/08/06.
- (4) THIS PERMISSION IS GRANTED ONLY FOR THE PROPOSED BUILDING (BLOCK). CORRECTNESS/APPROVAL FOR THE REMAINING STRUCTURES/BUILDING OTHER THAN THIS PROPOSED BUILDING (BLOCK) SHOWN IN THIS PLAN ARE NOT ENDORSED BY THIS PERMISSION IN ANY MANNER AND ARE SHOWN FOR THE ORIENTATION PURPOSE ONLY.
- (5) THIS PERMISSION IS GRANTED SUBJECT TO CONDITION THAT IN THE PLOT BUILDING UNIT WHERE DRAINAGE SEWERAGE CONNECTION TO AMC NETWORK IS NOT FEASIBLE DUE TO NON WORKING STATUS OF SOAK WELL IN THE BUILDING UNIT (AS PER CIRCULAR NO. 18/2011-2012).
- (6) THIS CASE HAS BEEN SCRUTINIZED AND APPROVED BY BUILDING PLAN SCRUTINY POOL ON DT. 11/06/2013.
- (7) THIS PERMISSION IS GIVEN ON THE BASIS OF MEASUREMENT & LOCATION OF PLOT MENTIONED IN OPINION FOR SCHEME IMPLEMENTATION GIVEN BY TOWN DEV. INSP. (E2)/A.M.C. ON DT. 08/04/2013.
- (8) THIS PERMISSION IS GIVEN ON THE BASIS OF OPINION FOR NET DEMAND (BETTERMENT CHARGES) GIVEN BY ASSIT. CITY PLANNER, CITY PLANNING DEPT. IN THEIR LETTER NO. LCPD/A.M.C./GEN/153 ON DT. 10/04/2013.
- (9) ALL RELEVANT TERMS AND CONDITIONS MENTIONED IN N.A. PERMISSION GIVEN BY DY. COLLECTOR (VIRAMGAM) DATE: 15/09/2007 VIDE LETTER NO. LAND/NA/C-2057/07/SR-11/2007, WILL BE APPLICABLE AND BINDING TO OWNER/APPLICANT.
- (10) THIS PERMISSION IS GRANTED AS PER T.P.I. OPINION ON DT. 03/06/2013. THE FINAL PLOT IS SITUATED OUTSIDE THE BOUNDARY OF HAZARDOUS WASTE LAND & FILLING SITE.

For Other Terms & Conditions See Overleaf



:: शरीर ::

- વિપરજનવેલ મોડેરન શરતોની ભગ છત્રે તો આપેલ ઔષધકામને આગળ પમાણવનું વિજ્ઞાપિતી એ જાણમાં આણશે